

ત્વરિત જાહેરાત માટે

સીટી ઓફ બ્રેમ્પટને COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સમગ્ર શહેરમાં અને કેનેડામાં પ્રથમ બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામની જાહેરાત કરી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (એપ્રિલ 16, 2020) – ગઈકાલે, સીટી ઓફ બ્રેમ્પટને બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામ શરૂ કર્યો, એક નવી પર્યાવરણ-અનુકૂળ (ઈકો-ફ્રેન્ડલી) પહેલ જે આપણાં શહેરમાં ખાદ્ય સુરક્ષાને સહાયતા કરવામાં મદદરૂપ થશે, અને રહેવાસીઓને COVID-19 કટોકટી દરમિયાન ઘરે સક્રિય રહેવા પ્રોત્સાહિત કરશે. સીટી ઓફ બ્રેમ્પટન COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં પોતાના બગીચાઓ ઉગાડવામાં રહેવાસીઓને સહાયરૂપ થવા સમગ્ર શહેરમાં પહેલ શરૂ કરનાર કેનેડામાં પ્રથમ મ્યુનિસિપાલિટી છે.

નવા બ્રેમ્પટન બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામનું અધ્યક્ષપદ વોર્ડ્સ 2 અને 6 માં, સીટી કાઉન્સિલર ડગ વ્હિલ્લન્સ (Doug Whillans), સીટીના પાર્ક્સ એન્ડ ફોરેસ્ટરી ડિવિઝન સાથેની ભાગીદારીમાં સંભાળશે, અને જરૂરિયાત મુજબ સામુદાયિક ભાગીદારોને સમાવશે.

શારીરિક અંતર રાખવાના પગલાઓ અમલમાં છે ત્યારે, આ કાર્યક્રમ રહેવાસીઓને ઉત્પાદન અને ઔષધિઓ આરામથી પોતાના ઘરે ઉગાડવા, અને તેઓએ ઘરે ઉગાડેલો પાક સ્થાનિક ફૂડ બેંક્સ અને સામુદાયિક સંસ્થાઓને દાન કરવા પ્રોત્સાહિત કરે છે. ખાદ્ય પદાર્થો જરૂરિયાતમંદોને સરખા પ્રમાણમાં વહેંચવાની ખાતરી કરવાના હેતુસર, ફૂડ બેંક્સ અને સંસ્થાઓએ ભરવાનું એક રિક્વેસ્ટ ફોર્મ ઉપલબ્ધ કરવામાં આવશે.

આ ખાદ્ય સુરક્ષા પર મેયરની સોશિયલ સપોર્ટ ટાસ્ક ફોર્સની ધ્યાન કેન્દ્રિત કરવાની પહેલનો ટેકો છે અને સીટીને કાયમી હરિયાળુ શહેર (ગ્રીન સીટી) બનાવવાની અગ્રતાને દૃઢ નિશ્ચયી બનાવે છે.

નવો બેક્યાર્ડ ગાર્ડન પ્રોગ્રામ, જેના મારફતે રહેવાસીઓ સક્રિય રહેવાનું અને હરિયાળી જાળવવાનું ચાલુ રાખી શકે છે, તે પ્રવર્તમાન સામુદાયિક બગીચાઓના કાર્યક્રમનું વિસ્તરણ છે.

રહેવાસીઓ મફત પુસ્તકો (માટી અને બીયારણ) મેળવવાની વિનંતી ઈમેઈલથી મોકલી શકે છે,

BramptonGreenCity@brampton.ca. અમે બગીચાઓની જાળવણી કરવાની રીતો પર શૈક્ષણિક માહિતી અને સૂચનો અમારી વેબસાઈટ પર વહેંચીશું www.brampton.ca/parks.

અર્થ ડે (પૃથ્વી દિવસ)ની 50^{મી} વર્ષગાંઠ (બુધવાર, એપ્રિલ 22 નાં રોજ) આવવાની તૈયારીમાં છે ત્યારે, રહેવાસીઓ માટે શહેરી ખેતીમાં ફાળો આપવાની, સમુદાયને કંઈક પરત કરવાની, અને બ્રેમ્પટનને વધારે આરોગ્યપ્રદ, લચીલું, અને પર્યાવરણની દૃષ્ટિએ ટકાઉ શહેર બનાવવામાં મદદરૂપ થવાની આ પરિપૂર્ણ તક છે. અહીં ઘરે અર્થ ડે ઉજવવા કેટલાક [સૂચનો](#) કરવામાં આવ્યા છે.

જરૂરી દાન

જો તમે શહેરને બગીચાકામ માટેની માટી અને શાકાહારી છોડ અને બીયારણનું દાન કરી શકતો એક ધંધો ધરાવતા હો તો, કૃપા કરી ઈમેઈલ મોકલો, BramptonGreenCity@brampton.ca.

COVID-19 ની પરિસ્થિતિ દરમિયાન સીટી ઓફ બ્રેમ્પટન શું કરી રહ્યું છે તે સંબંધિત અદ્યતન માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, www.brampton.ca/COVID19.

અવતરણો (ક્વોટ્સ):

“અમારા રહેવાસીઓ અને સામુદાયિક સમૂહોને આ મહામારી દરમિયાન સહાયરૂપ થવું એ અમારી મુખ્ય અગ્રતા છે. અમારું સોશિયલ સપોર્ટ ટાસ્ક ફોર્સ બ્રેમ્પટનના સંવેદનશીલ સમુદાયોને જરૂરી ખોરાક સહાયતા પૂરી પાડવા અને આ હેતુસર જોડાવવા રહેવાસીઓને સશક્ત બનાવવા અને પોતાના બેંકયાર્ડ્સમાં તાજુ ઉત્પાદ ઉગાડવા સખત મહેનત કરી રહ્યું છે. બ્રેમ્પટન રહેવાસીઓની સહાયતાથી, અમે આ કાર્યક્રમ મારફતે 1,000 નવા બેંકયાર્ડ ગાર્ડન્સ શરૂ કરવાનો હેતુ ધરાવીએ છીએ. સાથે મળીને, આપણે સક્રિય બનીને અને સમુદાયને ગૌરવ અનુભવવામાં પોષણ પૂરું પાડીને, આપણી ફૂડ બેંક્સ પરનું ભારણ ઓછું કરવામાં મદદરૂપ બની શકીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“અમારો કમ્યુનિટી ગાર્ડન્સ પ્રોગ્રામ બહુ સફળ રહ્યો છે, અને અત્યારે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવવાના ઉપાયો અમલમાં હોવાને લીધે અમે તે સરખી રીતે કમ્યુનિટી ગાર્ડન્સ ચલાવવા એટલા સક્ષમ ન બનીએ તો પણ, તે બંધબેસતો એકમાત્ર અનુકૂળ કાર્યક્રમ છે જે અમે સીધો રહેવાસીઓ માટે લાવી શકીએ છીએ. આ કાર્યક્રમ તમામ રહેવાસીઓને બગીચાકામ કરવા, આઈસોલેટ (અલગ) રહીને પણ આઉટડોર્સનો આનંદ માણવા, અને સમુદાયમાં આપણાં વડીલો અને જરૂરિયાતમંદોને કંઈક પરત કરવા પ્રોત્સાહિત કરે છે.”

- ડગ વ્હિલ્લન્સ (Doug Whillans), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 2 અને 6, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટન એક ફ્લાવર સીટી તરીકે બહુ જાણીતું છે અને આ પડકારભર્યા સમય દરમિયાન સીટી કર્મચારીઓ રહેવાસીઓ ઘરે છે ત્યારે તેઓને સક્રિય રહેવામાં સહાયરૂપ થવા બેંકયાર્ડ ગાર્ડન પ્રોગ્રામ અમલમાં મૂકવા, કાઉન્સિલની મહત્વની અગ્રતા પરિભાષા એવા હરીયાળા શહેર તરીકે બ્રેમ્પટનને વિકસાવવા, અને બ્રેમ્પટનમાં ખાદ્ય સુરક્ષામાં ફાળો આપવા કટિબદ્ધ છે.”

- ડેવિડ બાર્રિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca